



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૨/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૭૧/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૫ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૧૨૪ લીટર દેશી દારૂ, ૬૦૪ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૭૨ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી, ૨૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૫૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૭૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૨૭૩/૧૯

ઈસનપુર : પ્રવિણકુમાર ગોવિંદભાઈ પરમાર (રહે.ચાણક્ય એપાર્ટમેન્ટ વિભાગ-૦૨ મીરા સિનેમા ચાર રસ્તા પાસે શાહઆલમ ઇસનપુર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા. ૧૦/૦૨/૨૦૧૯ ના કલાક ૯/૦૦ થી બપોરના ૩/૩૦ વાગ્યા દરમિયાન પોતાના ઘરના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોનાના દાગીના તથા પાવર બેંક કિંમત રૂપિયા ૨૦૦/- મળી કુલ રૂપિયા ૫૦,૨૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૨૭૪/૧૯

સરદારનગર : રમેશભાઈ દેવલદાસ લખાણી (ઉ.વ.૪૮)(રહે. નીલકંઠ સોસા માયા સીનેમા પાસે કુબેરનગર સરદારનગર) તા.૦૯/૦૨/૧૯ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે શાંતીપ્રકાશ હોસ્પિટલની આગળ રોડ ઉપરથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) એ ભેગામળી રમેશભાઈને લાફો મારી એક્ટીવાના હુકમાં લટકાવેલ રૂપિયા ૧,૦૦,૦૦૦/- મુકેલ થેલી ખેંચી લઈ નાસી ગયા હતા. આ અંગે રમેશભાઈ લખાણી એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.કે.મોથલિયા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૭૫/૧૯

કારંજ : હેતલબહેન વા/ઓ લાલુપ્રસાદ ઓઝા(ઉ.વ.૨૩)(રહે.ગામ-૨૬કા તા-સુઇગામ જી- બનાસકાંઠા) તા.૧૦/૦૨/૨૦૧૯ ના કલાક ૧૨/૩૦ થી ૧/૩૦ વાગ્યા દરમ્યાન ઢાલગરવાડ ના નાકા પાસે ખરીદી કરવા આવેલ હતા દરમ્યાન કોઇ અજાણી વ્યક્તિ હેતલબહેનના મોટા પર્સ ને ચેકો મારી, તેમાથી હેંડ પર્સ કે જેમાં રોકડ રૂપિયા ૩૫,૦૦૦/-, સોનાની બુટી કિંમત રૂપિયા ૫,૦૦૦/-, સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૦,૦૦૦/- ની મતા મુકેલ હતી તે પર્સ ની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.ઓડેદરા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૭૬/૧૯

વેજલપુર: સંગીતાબહેન જસુજી ઠાકોર (ઉ.વ.૧૪) (રહે. વેજલપુર ગામ મુખીવાસ રાજુલા પાર્ક સામે વેજલપુર) એ અગમ્ય કારણસર તા.૧૦/૦૨/૧૯ બપોરના ૪/૨૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સડી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.બારૈયા ચલાવે છે.

કારંજ: અશોકભાઇ મજાભાઇ દંતાણી (ઉ.વ.૪૫) (રહે.શંકરભુવનના છાપરા દેવીપુજકની ચાલી શાહપુર) એ અર્થિક પરિસ્થિતી સારી ના હોઇ મનમાં લાગી આવતા તા.૯/૨/૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે લાલદરવાજા અપના બજાર ખાતે ઝેરી પ્રવાહી પી લીધુ હતુ. સારવાર માટે વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૦/૨/૧૯ કલાક ૫/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતુ. આ અંગે કારંજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આઈ.મકરાણી ચલાવે છે.

નરોડા: પ્રકાશ શોભનાથ મહંતો (ઉ.વ.૨૮) (રહે. ગોપાલનગર ગોકુલધામ સોસાયટી નાના ચિલોડા ગામ નરોડા) એ બિમારીથી કંટાળી તા.૧૦/૦૨/૧૯ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી યોગેશભાઈ નારાયણભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: રાજેશભાઇ રામાભાઇ બારેડ (રહે.સુર્યનારાયણ સોસાયટી ગોપાલચોક પાસે નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૦/૦૨/૧૯ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.કો.શ્રી હરદીપસિંહ બલભદ્રસિંહ ચલાવે છે.

અમરાઈવાડી: ગીતાબહેન વા/ઓ મંગાભાઇ (ઉ.વ.૩૫) (રહે. મહાલક્ષ્મીનગર જોગમાયાનગર સામે અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૦૯/૦૨/૧૯ રાતના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી સી.પી.રાવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.